

‘મૂછળી મા’ ગિજુભાઇ બધેકા

(જ્મા પાનાથી ચાલુ)

તારાબહને જે કામ કર્યું છે તે કોઈ પણ સમાજન મળવાર બનવે રેવું હતું. બાળકોના ઉદ્ઘારકતા ગિજુભાઈએ અસંખ્ય અભાપોને બાળસ્વાતંચની, બાળબક્તિની અને બાળપ્રેમની દીક્ષા આપી. ગુજરાતને બાળબક્તિનું ગાંડપણ લગાડનાર આ બંને મિશનરીઓએ મધ્યમ વર્ગનું આખું સ્વરૂપ ફેરવી નાંખું છે અને ગુજરાતમાં અસંખ્ય બાળમંદિરો વાવી ઉગાડ્યાં છે.

શ્રી ગિજુભાઈના મત પ્રમાણે “બાળકને સ્વતંત્ર વ્યક્તિત્વ હોઈ શકે છે. બાળકને મારશો નહિ, બિવડાવથી નહિ એવાં સૂત્રો પોકારીને તેમજો જૂની રૂઠિના શિક્ષકોને ઉભાતાવી નાખ્યા. રાજ્યપુરુષો જે કાંતિ ન કરી શકે તેવી કાંતિ ગિજુભાઈએ આવાં સૂત્રો દારા આણા દેશના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં આપી.”

વકીલાતનો વ્યવસાય છોડીને શિક્ષણ કેને આવેલા શ્રી ગિજુભાઈએ બાળકોને મારે વકીલાત

કરી અને તેમના ન્યાયધીશ બન્યા. કર્તૃ મેડમ મોન્ટેસોરીને પોતાના ગુરુ માનતા અને મેડમ મોન્ટેસોરીનામાં કરેલા પ્રયોગમાંથી ધ્યાન માર્ગદર્શન દે પણ મેળવ્યું હતું.

આદર્શ બાલશિક્ષકના ગુણોનું શદ્ધચિત્ર શ્રી રામનારાયણ ના. પાઠક દારા તેમના પુસ્તક ‘બાળ શિક્ષણ પ્રણોત્તા ગિજુભાઈ’ પૃ. ૧૫૩ પર બહુ જ યથાથ આલોચાયેલું છે.

સાભાર પ્રસ્તુત છે તેમાંના થોડા અંશો—“બાળમંદિરના ઉંચા પગથાર પર ઉભેલા ગિજુભાઈએ ટેકરી પર પતંગિયા પેટે ઉડતાં આવતાં બાળકોને ડેંશી આવકાર્ય. બે હાથ જોડી. નમતા અને પ્રેમપૂર્વક સામસામા નમરસ્કારવિધિ થાય. એક એક બાળકના અંતરમાં ગિજુભાઈ ડોકિયું કરે. બાળકો સાથેના સામાન્ય પ્રશ્નોના સામાન્ય જવાબોમાંથી ગિજુભાઈના અંતરમાં અસામાન્ય સંવેદન જાગી ઉટે. દરેક બાળકની વિકાસ ભૂમિનો ગિજુભાઈ તાગ મેળવે અને ત્યાંથી તેને આગળ વધવાના માર્ગ વિચારે. વહાલસોઈ માતાની પેટ ગિજુભાઈ અધૂરાં ને આણવિકસ્યાં, દુભાયેલાં ને તરછોડાયેલાં, ચિમળાયેલાં બાળકોને પોતાની સોડમાં લે અને તેને ખખર પણ ન પડે તેવી રીતે તેની બિડાયેલી અંતર કણીઓને વિકસાવવાનો માર્ગ મોકળો કરે... બાળકોના અંતરમાં પ્રવેશવાની ગિજુભાઈની રીત જીવનવિજ્ઞાના જ્ઞાનકારની સાચી રીત હતી.. મનોવૈજ્ઞાનિકી શાર્ટેરશ્યાદ દ્રષ્ટિ ગિજુભાઈને ઉડા આત્મમથન અને આત્મવિચારમાંથી પ્રાપ થઈ હતી.. શિક્ષણશાસ્ત્ર તેમને ટેકો ને પ્રોત્સાહન આપતું હતું. ઉધાડા પુસ્તકમાં પ્રત્યક્ષ બાળકો તેમની શ્રદ્ધાને દ્રબ્દ કરતાં હતાં.”

દરેક માતા-પિતાના અંતરની એક ઉડી અભિવાસા હોય કે તેમના સંતાનોને પણ બાળપણના શરૂઆતના ઘડતરના વર્ષોમાં આદર્શ શિક્ષકનો સાથ-સંગાથ સૌપદે. બાળ-વિકાસના પ્રારંભિક વર્ષોમાં કણજીપૂર્વકનું જતન થઈ શકે તે બહુ જ જરૂરી છે. આ તબક્કે બાળશિક્ષણ સાથે જોડાયેલી દરેક વ્યક્તિની જવાબદારી ધર્યો જ વધી જાય છે. કારણ કે માતા પદી જો કોઈ અન્યના સંપર્કમાં બાળકને આવવાનું થતું હોય, તો તે છે બાળમંદિરના શિક્ષિકાઓ/શિક્ષકો. જે સલામતી,

ગુજરાત જ નહીં... પણ ભારતમાં બાલશિક્ષણ
અંગે નવા અભિગમનો પાયો નાખનાર

‘‘મૂછળી મા’’ - ગિજુભાઇ બધેકા

‘‘હું નાના શરીરમાં રહેલ મહાન આત્માનું પણ પણે દર્શન કરે છું. જો અદ્ભૂત દર્શન જ મને જાળકોના હક્કો મારે જીવવા અને મરવા પ્રેર છે.’’

-ગિજુભાઇ બધેકા

બાળમાનસની ભીતરમાં

જગદીશ કામાણી
પંચાયુલ


૧૪ યારે કોઈ સમગ્ર સમાજના હિત ખાતર એક હિદ્ય વિચારને આકાર આપે છે ત્યારે ચરિતાર્થ થાય છે એક ચિરંચુલ કાર્ય એ કાર્યને પણ નોંધું શક્યા. હદ્યના ઉપમા આપી શકાય. હદ્યના નિરવાર્થ ભાવે અંકુરિત થતી ઉદાર ભાવના જ્યારે પાંગરી છે ત્યારે તેના છાંયાડાયાં દસ્કાઓ અને કાયરેક સદીઓ સુધી માનવ સમાજ મહેક માણસો રહે છે.

જે શહેરને કોઈ અન્ય વ્યક્તિએ સદાને મારે યાદગાર બનાવી દીધું હોય, માત્ર તે શહેર જ નહીં, આજુભાજુના વિસ્તારો અને સમગ્ર રાજ્યની પ્રજા તેમના કર્મયજ્ઞને યાદ કરી ગૌરવ અનુભવી શકે છે.

આજીથી સિતોરે વર્ષ પહેલાં ઓગષ્ટની પહેલી તારીખ ૧૯૨૦ના રોજ આ ગૌરવ મળ્યું ભાવનગર શહેરને. તે હિવસે બાલમંદિરનું બીજારોપણ થયું, તે મંદિરમાં બાળપુષ્પોને ખીલવવાનું કાર્ય હાથમાં ઉપાયું શ્રી ગિજુભાઈ બધેકાએ. તેઓ માનતા કે બાળપણથી જ સંસ્કાર સિંચન કરવું જોઈએ, અને આમ આપણાને જે બાલમંદિર મળ્યું તેમાં શરૂઆતમાં ચાણીસ બાળક જોડાયા. બાલમંદિર મારે થોડા રમકડાંઓ ખરીદવામાં આવ્યા થોડા ભેટ તરીકે પણ મળ્યા. તે સમયે લોકો માનતા કે નાના છોકરાની નિશાળ કાઢવી છે એમાં પૈસા લેવાના ન હોય.

કેળવણીકાર સુમતિબહન વૈદ્ય લાપે છે “તપ વગર સિદ્ધિ નથી.” એ શ્રી ગિજુભાઈનો જીવનમંત્ર હતો. એ

મંત્ર તેમની જીબે ન હતો પણ તેમના જીવનમાં વણાયેલો હતો. અત્યારનું આપણું બાલ શિક્ષણ તેમજ બાલ અધ્યાત્મ મંદિર તો તેમણે પાડેલા ગોલે ચાલે છે. પણ તેમણે જ્યારે આ



કાર્ય થડુ કર્યું ત્યારે તો ગુજરાતમાં બલકે હિદમા જ આ આખું કોત્ર બિનખેડાયેલ હતું એમ કહીએ તો ચાલે. શ્રી કાકાસાહેબે શ્રી ગિજુભાઈને જે અંજલિ આપી છે તે જોઈએ તો વિશેષ ઘ્યાલ આવશે. “એ જમાનામાં ગિજુભાઈએ અને

(જુઓ પાનું ૧૦)

સ્વીકૃતિ અનુ હું બાળકને માતા પાસેથી મળતી હોય, તેવી જ અપેક્ષા સાથે બાળક બાલમંદિરમાં આવતું હોય છે.

અપવાદને બાદ કરતાં, આજે અસંખ્ય કુમળા બાળકો તેમના બાળપણની અમૂલ્ય, અલખ્ય પાણી કદી ન મળનારી કાણોને માણવાની, ખીલવવાની તક ગુમાવી રહ્યા હોય છે. ત્યારે તેના માતા-પિતાને પણ અસહાય બની કરુને પણ યથાસ્થિતિને સ્વીકારી લેવી પડે છે, તે પણ એક વિંબના જ છે ને?

સંદર્ભ સૌજન્ય

(૧) પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પથદર્શન (૨) લે. સુમતિબહન પ્રા. વૈદ્ય (૩) બાળશિક્ષણ પ્રણોત્તા ગિજુભાઈ લે. રામનારાયણ નાગરદાસ પાઠક